https://archive.org/details/bk835/page/n0/mode/1up

1936-09-14 -Pamphlet -Mubarakbadi (835)

All Items on https://archive.org/details/realpatidar

પાટીદાર પત્રિકા નંબર ૨, જો.

realpatidar.com

ગામ પાનેલી, મેંઘપર, દેવીસર અને નખત્રાણાના ભાઇઓને

મુબારકબાદી.

Full Library on https://realpatidar.com/library

પીરાણાપંથી ભાઇઓને ખાસ ચેતવણી.
યુવકોને સમયસરની સુચના.

મને લખતાં આનંદ થાય છે કે મારી પત્રીકા બહાર પડવા પછી અમારા ગામ નખત્રાણાવારા જ્ઞાતિ ભાઇઓ મંદિરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રતિષ્ટા વખતે દેશપરદેશથી જ્ઞાતિના ભાઇઓને બોલાવીને પરિષદની જનરલ મીટીંગ કેવીરીતે ભરવી તેનો વીચાર કરી રહ્યા છે તેમજ મારા એક મીત્ર તરફથી મને ખબર મલ્યા છે કે ગામ દેવીસરવાળા જ્ઞાતિ ભાઇઓએ ગયા શ્રાવણ વદી ૮ જન્માષ્ટમીના દિવસે ગામ દેવીસરની ખાનાની જગ્યામાં પીરાણાના પાટ ઉપર જે પીરાણાના પીરના રોજાની છબી રાખેલી હતી તે ઉપાડીને તેની જગ્યાએ શ્રી સત્યનારાયણ ભગવાનની પાન મુર્તિ પધરાવી છે. જો આ વાત ખરી હોય તો તે ભાઇઓને તથા ગામ પાનેલી અને મેંઘપરના જ્ઞાતિ ભાઇઓએ પીરાણાના પાખંડને કાઢી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યા છે તેથી તે સરવે ભાઇઓને હું મુબારકબાદી આપું છું. અને ઇશ્વર પાસે પ્રાર્થના કરૂ છું કે જે બન્ધુઓએ હીમત કરીને પીરાણાના પાપને કાઢ્યું છે તે ભાઇઓને તેમના કામની અંદર યશ અને ફતેહ આપે.

આ ઉપરની ખબરથી મને આનંદ થાય છે તેની સાથે દીલગીરી માત્ર એટલી છે કે ગામ નખત્રાણાવાસી ભાઇઓ હજી શા માટે આટલા મુંઝાય છે ખુલી હીંમત શા માટે નથી કરતા તેઓની પાસે હામ, દામ, અને ઠામ પુષ્કળ છે છતાંપણ આવા મંદ વિચાર શા માટે રાખતા હશે તેનું કારણ શું? તે કાંઇપણ સમજાતું નથી પણ ખેર, જે હશે તે દેખાઇ રહેશે હાલમાંતો આટલી તેઓની હીમતને ધન્યવાદ આપુ છું.

હવે મારે મારા પરદેશવાસી જ્ઞાતિભાઇઓ કે જેઓ પીરાણાના પાપને હજીપણ વળગી રહ્યા છે તેને ખાસ ચેતવણી આપવી પડે છે કે હવે તમારી ઉંઘને ઉડાડો અને આખ ખોલી જુઓ કે તમારા સ્વદેશવાસી ભાઇઓ જ્યારે આમ આગળ વધી રહ્યા છે. ત્યારે તમો પરદેશ તેમાં ખાસ કરાચીવાસી ભાઇઓ હજી પણ પીરાણાના સૈયદોને તેડાવો છો ને તેના પાસેથી ગુરૂમંત્ર લ્યો છો અરે ભાઇઓ છે તમોને કાંઇ સાન. તે યવનોએ તો તમારા હાલ બેહાલ કરી આખી દુન્યામાં હડધૂત કરી મુકયા છે તેથી મહેરબાની કરી હવે પીરાણાનાં પાખંડી સૈયદોને મુકો તેઓના શિષ્ય થઇ હુરાંઓ (રાંડો) મહાલવાનું માંડી વાળો ભાઇઓ એ નીચ ગુરૂઓ (સૈયદો) તો તમોને અંતને વખતે પણ રાંડોનીજ લાલચો આપે છે જો આહી કને કોઇપણ ગરીબ ભાઇ ભુલેચુકે પણ પરસ્ત્રી સામું જુએ છે તો તમો તેને પાયમાલ કરી મુકો છો અને તમારા એ યવન ગુરૂઓ તો છડેચોક તમોને વ્યભિચારી બનાવે છે અને હજાર હજાર રાંડો ભોગવવાની લાલચો આપે છે. તેથી હું તમોને પુછું છું કે પીરાણાના સૈયદોના શિષ્યો કેટલા? તે દરેક ભક્તને હજોર હજાર રાંડો આપશે તો તમારા પીરાણાના પીરે કેટલી હુરાઓ (સ્ત્રી) ભેગી કરીને કેટલાની આમ દલાલી કરી છે, તેનો તો હીસાબ તેઓને પુછો? વખતે સૈયદોના શિષ્યો કરતાં હુરાંઓ ઓછી થઇ જશે તો પછી તમો ધોબીના કુતરાના જેમ ન ઘરના કે ન ઘાટના થશો. જે ધર્મના ધર્મ-ગુરૂઓ આમ બાયડીઓના દલાલી કરતા હોય તે ધર્મ પાળવાથી અંત ફળ શું મળે? "કોયલા બળે તો રાખ" તેથ. તમોને હું કહુછું કે ભાઇઓ હજીપણ વખત છે હિંદુ સમાજ મોટા દીલના છે તમારા જેવા અનેક ભુલેલા પતીતોનો તેણે ઉધાર કર્યો છે તે જરૂરથા તમોને પણ રસ્તે ચડાવાને સંગરસે તમે વિચાર કરીને વેદ ધર્મનું શરણું લ્યો અને પીરાણાના પાખંડી ખીચડીઆ પંથને મુકો એજ મારી તમોને ખાસ ચેતવણી છે.

સુધારકોને સમયસરની સૂચના.

મને ન છુટકે લખવું પડે છે કે મારી પહેલી પત્રીકા છપાઇ બહાર પડી તે વખતે તો અમારા કરાચી યુવક મંડળના બન્ન સેક્રેટરીઓજ બહુ જોરમાં હતા, ભાઇ રતનશી શીવજી કહેતા હતા કે રૈયોની પત્રીકા બહાર પડે કે હું તુરતમાં જવાબ આપીશ. તેમજ ભાઇ શીવજી કાનજીએ તો કેટલાએ ભાઇઓ આગળ કહેલ કે હું રૈયાનું મોઢું એવું તો બંધ કરી દહીશ કે પાછું કોઇપણ દિવસ કાંઇપણ લખી કે બોલી પણ શકે નહિ આવા આવા ગામ ગપાટા સાંભળી મને બહુ હરખ થતો હતો કે અમારા ભાઇઓની ઉંઘ હવે ઉડી પણ દીલગીરી થાય છે કે આજ દિવસ સુધી કોઇ ભાઇ મને કાંઇપણ કહેવાને બહાર આવ્યો એવું મેં સાંભળ્યું નથી તેથી ઘણો નારાજ થઇને હું વળી પણ લખું છું કે ભાઇઓ હું તમોને સાચું કહું છું છતાંપણ મારા ઉપર તમોને ગુસ્સો આવે છે પણ પેલા પીરાણાપંથી ભાઇઓ જે સૈયદોને હરવખત તેડાવે છે તેઓને તો તમો જરાપણ કહેવાની હીમત કરતા નથી. તેનું કારણ શું? "નબળો માટી બૈયર પર સુરો" તે હીસાબે મનેજ ડરાવી મારૂં મોઢું બંધ કરવાનું જોર બતાવો છો તેટલુંજ કે, તેથી અરધું પણ જોર જ્ઞાતિ સેવામાં વાપરતા હો, તો મને ઉમેદ છે, કે આપણી જ્ઞાતિ ક્યારનીએ પાપી પીરાણા પંથથી છુટી ગઇ હોત.

realpatidar.com

https://archive.org/details/bk835/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 1, 2.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk835/page/n2/mode/1up

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 16:50:22 +05'30'

Real Patidar
Unravel Truth

1936-09-14 -Pamphlet -Mubarakbadi (835)

પાટીદાર પત્રિકા નંબર ૨, જો.

ગામ પાનેલી, મેંઘપર, દેવીસર અને નખત્રાણાના ભાઇઓને

realpatidar.com

મુબારકબાદી.

પીરાણાપંથી ભાઇઓને ખાસ ચેતવણી.
યુવકોને સમયસરની સુચના.

10-Aug-1936 -Devisar converted Khana to Mandir

મને લખતાં આનંદ થાય છે કે મારી પત્રીકા બહાર પડવા પછી અમારા ગામ નખત્રાણાવારા જ્ઞાતિ ભાઇઓ મંદિરમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રતિષ્ટા વખતે દેશપરદેશથી જ્ઞાતિના ભાઇઓને બોલાવીને પરિષદની જનરલ મીટીંગ કેવીરીતે ભરવી તેનો વીચાર કરી રહ્યા છે તેમજ મારા એક મીત્ર તરફથી મને ખબર મલ્યા છે કે ગામ દેવીસરવાળા જ્ઞાતિ ભાઇઓએ ગયા શ્રાવણ વદી ૮ જન્માષ્ટમીના દિવસે ગામ દેવીસરની ખાનાની જગ્યામાં પીરાણાના પાટ ઉપર જે પીરાણાના પીરના રોજાની છબી રાખેલી હતી તે ઉપાડીને તેની જગ્યાએ શ્રી સત્યનારાયણ ભગવાનની પાન મુર્તિ પધરાવી છે. જો આ વાત ખરી હોય તો તે ભાઇઓને તથા ગામ પાનેલી અને મેંઘપરના જ્ઞાતિ ભાઇઓએ પીરાણાના પાખંડને કાઢી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવ્યા છે તેથી તે સરવે ભાઇઓને હું મુબારકબાદી આપું છું. અને ઇશ્વર પાસે પ્રાર્થના કરૂ છું કે જે બન્ધુઓએ હીમત કરીને પીરાણાના પાપને કાઢ્યું છે તે ભાઇઓને તેમના કામની અંદર યશ અને ફતેહ આપે.

આ ઉપરની ખબરથી મને આનંદ થાય છે તેની સાથે દીલગીરી માત્ર એટલી છે કે ગામ નખત્રાણાવાસી ભાઇઓ હજી શા માટે આટલા મુંઝાય છે ખુલી હીંમત શા માટે નથી કરતા તેઓની પાસે હામ, દામ, અને ઠામ પુષ્કળ છે છતાંપણ આવા મંદ વિચાર શા માટે રાખતા હશે તેનું કારણ શું ? તે કાંઇપણ સમજાતું નથી પણ ખેર, જે હશે તે દેખાઇ રહેશે હાલમાંતો આટલી તેઓની હીમતને ધન્યવાદ આપુ છું.

હવે મારે મારા પરદેશવાસી જ્ઞાતિભાઇઓ કે જેઓ પીરાણાના પાપને હજીપણ વળગી રહ્યા છે તેને ખાસ ચેતવણી આપવી પડે છે કે હવે તમારી ઉંઘને ઉડાડો અને આખ ખોલી જુઓ કે તમારા સ્વદેશવાસી ભાઇઓ જ્યારે આમ આગળ વધી રહ્યા છે. ત્યારે તમો પરદેશ તેમાં ખાસ કરાચીવાસી ભાઇઓ હજી પણ પીરાણાના સૈયદોને તેડાવો છો ને તેના પાસેથી ગુરૂમંત્ર લ્યો છો અરે ભાઇઓ છે તમોને કાંઇ સાન. તે યવનોએ તો તમારા હાલ બેહાલ કરી આખી દુન્યામાં હડધૂત કરી મુકયા છે તેથી મહેરબાની કરી હવે પીરાણાનાં પાખંડી સૈયદોને મુકો તેઓના શિષ્ય થઇ હુરાંઓ (રાંડો) મહાલવાનું માંડી વાળો ભાઇઓ એ નીચ ગુરૂઓ (સૈયદો) તો તમોને અંતને વખતે પણ રાંડોનીજ લાલચો આપે છે જો આહી કને કોઇપણ ગરીબ ભાઇ ભુલેચુકે પણ પરસ્ત્રી સામું જુએ છે તો તમો તેને પાયમાલ કરી મુકો છો અને તમારા એ યવન ગુરૂઓ તો છડેચોક તમોને વ્યભિચારી બનાવે છે અને હજાર હજાર રાંડો ભોગવવાની લાલચો આપે છે. તેથી હું તમોને પુછું છું કે પીરાણાના સૈયદોના શિષ્યો કેટલા ? તે દરેક ભક્તને હજાર હજાર રાંડો આપશે તો તમારા પીરાણાના પીરે કેટલી હુરાઓ (સ્ત્રી) ભેગી કરીને કેટલાની આમ દલાલી કરી છે, તેનો તો હીસાબ તેઓને પુછો ? વખતે સૈયદોના શિષ્યો કરતાં હુરાંઓ ઓછી થઇ જશે તો પછી તમો ધોબીના કુતરાના જેમ ન ઘરના કે ન ઘાટના થશો. જે ધર્મના ધર્મ-ગુરૂઓ આમ બાયડીઓના દલાલી કરતા હોય તે ધર્મ પાળવાથી અંત ફળ શું મળે ? "કોયલા બળે તો રાખ" તેથ. તમોને હું કહુછું કે ભાઇઓ હજીપણ વખત છે હિંદુ સમાજ મોટા દીલના છે તમારા જેવા અનેક ભુલેલા પતીતોનો તેણે ઉધાર કર્યો છે તે જરૂરથા તમોને પણ રસ્તે ચડાવાને સંગરસે તમે વિચાર કરીને વેદ ધર્મનું શરણું લ્યો અને પીરાણાના પાખંડી ખીચડીઆ પંથને મુકો એજ મારી તમોને ખાસ ચેતવણી છે.

સુધારકોને સમયસરની સૂચના.

મને ન છુટકે લખવું પડે છે કે મારી પહેલી પત્રીકા છપાઇ બહાર પડી તે વખતે તો અમારા કરાચી યુવક મંડળના બન્ન સેક્રેટરીઓજ બહુ જોરમાં હતા, ભાઇ રતનશી શીવજી કહેતા હતા કે રૈયોની પત્રીકા બહાર પડે કે હું તુરતમાં જવાબ આપીશ. તેમજ ભાઇ શીવજી કાનજીએ તો કેટલાએ ભાઇઓ આગળ કહેલ કે હું રૈયાનું મોઢું એવું તો બંધ કરી દહીશ કે પાછું કોઇપણ દિવસ કાંઇપણ લખી કે બોલી પણ શકે નહિ આવા આવા ગામ ગપાટા સાંભળી મને બહુ હરખ થતો હતો કે અમારા ભાઇઓની ઉંઘ હવે ઉડી પણ દીલગીરી થાય છે કે આજ દિવસ સુધી કોઇ ભાઇ મને કાંઇપણ કહેવાને બહાર આવ્યો એવું મેં સાંભળ્યું નથી તેથી ઘણો નારાજ થઇને હું વળી પણ લખું છું કે ભાઇઓ હું તમોને સાચું કહું છું છતાંપણ મારા ઉપર તમોને ગુસ્સો આવે છે પણ પેલા પીરાણાપંથી ભાઇઓ જે સૈયદોને હરવખત તેડાવે છે તેઓને તો તમો જરાપણ કહેવાની હીમત કરતા નથી. તેનું કારણ શું ? "નબળો માટી બૈયર પર સુરો" તે હીસાબે મનેજ ડરાવી મારૂં મોઢું બંધ કરવાનું જોર બતાવો છો તેટલુંજ કે તેથી અરધું પણ જોર જ્ઞાતિ સેવામાં વાપરતા હો, તો મને ઉમેદ છે, કે આપણી જ્ઞાતિ કયારનીએ પાપી પીરાણા પંથથી છુટી ગઇ હોત.

realpatidar.com

https://archive.org/details/bk835/page/n3/mode/1up

મેં આખા કચ્છમાં આપણી જ્ઞાતિમાં પેપર મોકલ્યા છે પણ મને સાંભળવામાં આવ્યું છે કે ભાઇ નારાયણજી રામજી તથા રાજાભાઇ સામજીએ બીજાનાં કાગળમાં પોંચ લખી છે તે સિવાય બીજા ભાઇઓએ આજ દિવસ સુધી કોઇપણ જાતનો સદેશો મોકલ્યો નથી તેથી મારે માનવું પડે છે કે અમારા સુધારક ભાઇઓનો બીજાને બતાવવા પુરતોજ ઠાઠમાઠ ને દંભજ હતો, તેમ જો ન હોય તો પહેલી પરિષદ વખતે ભાઇ રતનશી ખીમજી કરાંચી આવવાને તૈયાર થાતા હતા, તે વખતેજ તેમના છોકરાં મુંબઇ આવી પહોંચ્યા ત્યારે ભાઇશ્રીને તેઓએ કહ્યું કે અમારૂં રહેવાનું કે ખાવાનું ક્યાં થશે? તેના જવાબમાં ભાઇ રતનશીએ કહ્યું કે તમારૂં ગમે તે થાય પણ હું તો મારી જ્ઞાતિ સેવા કરીશ આજ તેજ ભાઇ પેપરની પોંચ આપવાનું ભુલી જાય છે, તેથી હવે મારે માનવું શું? **સેવા કે દંભ.**

નામ રહતાં ઠાકરાં નાણાં નહિ રહંત,
કીરતી કેરાં કોટડાં પાડયાં નહિ પડંત.

ભાઇઓ પૈસો તો કઇ વખત આવે છે અને જાય છે પણ જ્ઞાતિ સેવા કરવાનો વખત વારે વારે નથી આવવાનો તેથી ભાઇ રતનશી ખીમજી વીગેરે ભાઇઓ હજીપણ વીચાર કરીને આળસરૂપી ઉંઘને ઉડાડે તો મને આશા છે કે જ્ઞાતિમાં સંપ સલાહ થવામાં જરાપણ વખત લાગે નહિ ભગવાન અમારા ભાઇઓને સુબુદ્ધિ આપે.

એજ ઇચ્છતો હું છું જ્ઞાતિ સેવક,

પટેલ રૈયા નાગજી ચોધરી,
નખત્રાણાવારા.

કરાચી,
તા. ૧૪-૯-૧૯૩૬

તા. ક.—મને કોઇપણ ભાઇ છપામણી ખર્ચની મદદ કરશે તો હું દર મહીને પત્રિકા બહાર પાડતો રહીશ.

દુર્ગા પ્રિન્ટીંગ પ્રેસ, વોટર કોર્સ રોડ,—કરાચી.

realpatidar.com